

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૩/૦૫/૨૦૧૬ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૨૨/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૪ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૮૬ લીટર દેશી દારૂ, ૦૩ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૧ કેસ કરી, ૦૨ વ્યક્તિઓને ઝડપી, જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૨૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ટ્રેઇન નીચે કપાઇ જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૮૨૪/૧૬

ચાંદખેડા : બિંદિયાબહેન વા.ઓ ઉમેશકુમાર દવે (ઉ.વ.૩૭)(રહે.રાજેશ્વરી રો હાઉસ, રેલવે સ્ટેશનની સામે, ચાંદખેડા) તા.૧/૫/૧૬ રાતનાં ૯/૩૫ વાગ્યાના સુમારે ચાંદખેડા રેલવે સ્ટેશનની સામે, ઉમા ભવાની ફાટક નજીક ટ્રેઇન નંબર ૧૯૭૦૮ નીચે કપાઇ જતાં તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોધી, આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.વાઢેર ચલાવે છે.

દાઝી જતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૮૨૫/૧૬

સાબરમતી : ધવલભાઇ જોગાજી ઠાકોર (ઉ.વ.૨૮)(રહે.ગાંધીવાસ, શંકરજીની ચાલી, મોટેરા રોડ, સાબરમતી) તા.૨૦/૪/૧૬ રાતનાં ૮/૩૦ વાગ્યાના સુમારે જનપથ ત્રણ રસ્તા ખાતે ચીરાગ બ્રેડ પકોડાની લારી ઉપર હાજર હતો દરમ્યાન ગરમ તેલની કઢાઇમાં પાણી પડતાં, ભડકો થતાં, શરીરે ગંભીર રીતે દાઝી જતાં, સારવાર માટે તેમને વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨/૫/૧૬ નાં કલાક ૧૦/૦૦ વાગે ધવલભાઇનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી રાજેશભાઇ માનસિંહ ચલાવે છે.

અપમૃત્યુ :-

સમાચાર યાદી નં.૮૨૬/૧૬

ઘાટલોડીયા : વંશ જીજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ.૭)(રહે.શિવમ ટેનામેન્ટ, અનાર બ્લોકની સામે, કે.કે.નગર રોડ, ઘાટલોડીયા) તા.૧/૫/૧૬ રાતનાં ૯/૪૫ વાગ્યાના સુમારે ઘાટલોડીયા સન એન્ડ સ્ટેપ ક્લબ ખાતે સ્વીમીંગ પુલમાં તરતો હતો ત્યારે તેને શરીરમાં કંઇક તકલીફ થતાં, બોલવાનું બંધ થઇ જતાં, સારવાર માટે તેને શિવાલીક આર્કેડમાં આવેલ બાળકોની હોસ્પિટલમાં લઇ જતાં, ફરજ પરનાં ડૉ.શ્રીએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે ઘાટલોડીયા પોલીસે અકસ્માત મોત નોધી, આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઇ કાળાભાઇ ચલાવે છે.

એલીસબ્રીજ : મોહનસિંગ ધનસિંગ કડેયા (ઉ.વ.૪૫)(રહે.ગોપી રેસ્ટોરન્ટ, વા.સા.હોસ્પીટલ એલીસબ્રીજ) તા.૨/૫/૧૬ બપોરનાં ૧/૨૫ વાગ્યાના સુમારે એલીસબ્રીજ, ગોપી રેસ્ટોરન્ટ ખાતે લોખંડનાં ઘોડા ઉપરથી નીચે પડી જતાં, માથાનાં ભાગે પંખો વાગતાં, સારવાર માટે તેમને વા.સા.હોસ્પીટલમાં લઈ જતાં, ફરજ પરનાં ડૉ.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી મગનભાઈ વેચાતભાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૨૭/૧૬

ચાંદખેડા : દિપકભાઈ ડાહ્યાભાઈ પરમાર (ઉ.વ.૪૨)(રહે.મેનાપાર્ક ધ્રુવ દર્શનની સામે, ચાંદખેડા) એ ઘરમાં સામાન્ય બોલાચાલી થતાં, તા.૨૮/૪/૧૬ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. સારવાર અર્થે તેમને લાઇફ લાઇન હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૨/૫/૧૬ નાં કલાક ૮/૨૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી અબ્દુલભાઈ મુસાભાઈ ચલાવે છે.

એલીસબ્રીજ : રણછોડજી પુંજાજી ઠાકોર (ઉ.વ.૮૫)(રહે.ભુદરપુરા ગામ, ઠાકોરવાસ, ઉત્કર્ષ સોસાયટી સામે, આંબાવાડી) એ કોઈ કારણસર તા.૧/૫/૧૬ બપોરના ૪/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે તેમને વી.એસ.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતનાં ૧૧/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યુ હતું. આ અંગે એલીસબ્રીજ પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.ડી.વસાવા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.